



सत्यमेव जयते

The Gujarat Government Gazette

SUPPLEMENT TO THE CENTRAL GAZETTE AND CENTRAL SECTION

PUBLISHED BY AUTHORITY

VOL. LXV] WEDNESDAY, 25th SEPTEMBER, 2024/ASHVINA 03, 1946 [No. 114

Separate paging is given to each part of the supplement to the Central Gazette and Central section in order that it may be filed as a separate compilation

PART-II

EXTRAORDINARY

સુરત મહાનગરપાલિકા

નગર રચના યોજના, સુરત નં. ૫૩ (મગોબ-ડુંભાલ) (બીજો ફેરફાર) નો મુસદ્દો પ્રસિધ્ધ કરવા બાબત.

અધિસૂચન

નં. ટીપીડી/આ/૨૩૮૧/૨૦૨૪.-આથી જાહેર કરવામાં આવે છે કે, મુસદ્દા રૂપ નગર રચના યોજના, સુરત નં. ૫૩(મગોબ-ડુંભાલ)(બીજો ફેરફાર) નો મુસદ્દો, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) અને અધિનિયમના નિયમો-૧૯૭૮ના નિયમ-૧૮ હેઠળ (યોજનાના મુસદ્દાની દરખાસ્ત) તૈયાર કરેલ છે. જેને આથી પ્રસિધ્ધ કરવામાં આવે છે.

અંતિમ નગર રચના યોજના સુરત નં. ૫૩ (મગોબ-ડુંભાલ)(બીજો ફેરફાર) માં એપ્રોપ્રિએટ ઓથોરીટી સુરત મહાનગરપાલિકાને હાઉસીંગ ફોર એસ.ઈ.ડબલ્યુ.એસ. ના જાહેર હેતુ માટે ફાળવેલ અનામત અંતિમખંડ નં. ૮૨ તથા “યુટીલીટીના સેન્ટર” ના જાહેર હેતુ માટે ફાળવેલ અનામત અંતિમખંડ નં. ૮૧ ની હદ / ક્ષેત્રફળમાં ફેરફાર કરી તદ અનુસાર અનામત અંતિમખંડ નં. ૮૨ પૈકીની ૨૮૪૪ ચો.મી. જમીન યુટીલીટી સેન્ટરના જાહેર હેતુ માટેના અનામત અંતિમખંડ નં. ૮૧ માં આમેજ કરવા આયોજનમાં ફેરફાર / પુનઃરચના કરવા માટે વેરીએશન કરવાની જરૂરીયાત હોય, ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ની જોગવાઈઓ હેઠળ વેરીએશન કરવા અંગે ઉક્ત જણાવેલ યોજનાના મુસદ્દાની એક નકલ જમીન માલિકો તેમજ હિતસંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરતના નોટીસ બોર્ડ પર રજાના દિવસો સિવાય ઓફિસ સમય દરમિયાન ખુલ્લી રાખવામાં આવેલ છે.

સરકારી રાજ્યપત્રમાં ઉપરોક્ત અધિસૂચન પ્રસિધ્ધ થયાની તારીખથી એક મહીનાની અંદર આ યોજનાથી અસર પામતી કોઈપણ વ્યક્તિ આ યોજના સંબંધમાં વાંધા/સૂચનો બે નકલોમાં લેખિતમાં કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકાને સુપ્રત કરશે તો, આવા વાંધાઓ ધ્યાને લેવામાં આવશે.

સુરત.

તા. ૨૪-૦૯-૨૦૨૪

સહિ/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિના તા. ૨૦-૦૮-૨૦૨૪ ના રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો.

મ્યુ.કમિશનરશ્રીના તા. ૦૮-૦૮-૨૦૨૪ ના પત્ર નં. સીમીસ/૮/૬ થી વિદિત થઈ, મુસદ્દારૂપ નગર રચના યોજના નં. ૫૩ (મગોબ-ડુંભાલ) (બીજો ફેરફાર) નો ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૪૨(૧) મુજબ મુસદ્દો પ્રસિધ્ધ કરવાની કાર્યવાહી કરવાનું તથા દરખાસ્ત સાથે સામેલ અધિસૂચન મંજૂર કરવાનું તથા તેને આનુસંગિક જરૂરી કાર્યવાહી કરવાનું તથા આ માટે તમામ જરૂરી કાર્યવાહી / પત્રવ્યવહાર કરવા મ્યુ.કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૫/૨૦૨૪ સર્વાનુમતે મંજૂર

સુરત મહાનગરપાલિકા

મોજે : મોટાવરાછા વિસ્તારની નગર રચના યોજના સુરત નં. ૮૪ (મોટાવરાછા) તૈયાર કરવા બાબત.

અધિસૂચન

નં. ટીપીડી/૨૩૮૨/૨૦૨૪.-ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬ (પ્રેસીડન્ટ એક્ટ નં. ૨૭)ની કલમ-૪૧ ની જોગવાઈઓ હેઠળ સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિના ઠરાવ નં. ૨૪/૨૦૨૪, તા. ૨૦-૦૮-૨૦૨૪ થી ઠરાવ મુજબ, સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૪(મોટાવરાછા) ની દરખાસ્તને અધિનિયમની કલમ-૪૧ (૧) હેઠળ મુખ્ય નગર નિયોજકશ્રી, ગુજરાત રાજ્યએ તા. ૧૪-૦૨-૨૦૨૪ થી આપેલ પરામર્શ અન્વયે નકશા નં. ટીપીએસ/૮૪ માં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવ્યા મુજબ મોજે : મોટાવરાછા વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૮૪(મોટાવરાછા) બનાવવા ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬ની કલમ-૪૧ (૨) મુજબ ઈરાદો જાહેર કરવામાં આવે છે. જે મુજબના નકશાની એક નકલ, જમીન માલિકો તેમજ હીત સંબંધ ધરાવનાર વ્યક્તિઓ તથા જાહેર જનતાને જોવા માટે ટાઉન પ્લાનરશ્રીની કચેરી, ટાઉન પ્લાનીંગ વિભાગ, સુરત મહાનગરપાલિકા, બહુમાળી બિલ્ડીંગની પાછળ, નાનપુરા, સુરત ખાતે રજાના દિવસો સિવાયનાં દિવસે ઓફિસ સમયમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે.

સુરત.

તા. ૨૪-૦૮-૨૦૨૪

સહિ/- અવાચ્ય

કમિશનર

સુરત મહાનગરપાલિકા

ઠરાવ

સુરત મહાનગરપાલિકાની નગર નિયોજન સમિતિની તા. ૨૦-૦૮-૨૦૨૪ ના રોજ મળેલ સભામાં નીચે મુજબનો ઠરાવ પસાર થયો હતો.

મ્યુ. કમિશનરશ્રીના તા. ૮-૮-૨૦૨૪ ના પત્ર નં. સીમીસ/૮/૫ થી વિદિત થઈ, સુરત મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ સુચિત નગર રચના યોજના, સુરત નં. ૮૪(મોટાવરાછા) ને મુખ્ય નગર નિયોજકશ્રી, ગાંધીનગરના પત્ર ક્રમાંક : દ.ગુ./સુરત/૪૧(૧)/નરયો નં. ૮૪ (મો.વ.)/૪૪૮, તા. ૧૪-૦૨-૨૦૨૪ થી અધિનિયમની કલમ-૪૧(૧) હેઠળ આપેલ પરામર્શ અન્વયે સુચિત નગર રચના યોજના સુરત નં. ૮૪(મોટાવરાછા) તૈયાર કરવા અંગે દરખાસ્ત સાથે સામેલ નકશામાં ગુલાબી ઘેરા રંગની રેખાથી દર્શાવેલ વિસ્તારમાં નગર રચના યોજના સુરત નં. ૮૪(મોટાવરાછા) બનાવવા ધી ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ, ૧૯૭૬ની કલમ-૪૧(૨) હેઠળ ઈરાદો જાહેર કરવાનું, ઈરાદો જાહેર કરવા અંગે સામેલ અધિસૂચન મંજૂર કરવાનું તથા સદર અધિસૂચનને બહોળો ફેલાવો ધરાવતા બે સ્થાનિક દૈનિકપત્રોમાં એક-એક વખત પ્રસિધ્ધ કરવાનું તથા ઈરાદો જાહેર કર્યા મુજબ તેને સરકારશ્રીનાં રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવા તેમજ મુસદ્દો તૈયાર કરી સરકારશ્રીમાં સાદર કરવાની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ. કમિશનરશ્રીને અધિકૃત કરવાનું ઠરાવવામાં આવે છે.

ઠરાવ નં. ૨૪/૨૦૨૪ સર્વાનુમતે મંજૂર

